

Inaugural Meeting of the IBSA National Security Advisers

August 25, 2021

આઈબીએસએ નેશનલ સિક્યોરિટી એડવાઈઝર્સની ઉદ્ઘાટન બેઠક

ઓગસ્ટ 25, 2021

1. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજિત દોવલ, કે.સી.એ બુધવાર 25 ઓગસ્ટ 2021ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આઈબીએસએ નેશનલ સિક્યોરિટી એડવાઈઝર્સની ઉદ્ઘાટન બેઠકનું યજમાનપદ સંભાળ્યું હતું.
2. આ બેઠક આગામી આઈબીએસએ સમિટ ઓફ લીડર્સની તૈયારીની પ્રક્રિયાના ભાગરૂપે બોલાવવામાં આવી હતી જે આઈબીએસએમાં ભારતના અધ્યક્ષપદ હેઠળ મળવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેઠળ ભારતના અધ્યક્ષપદે યોજાઈ રહેલી બેઠકની થિમ “ડેમોક્રેસી ફોર ડેમોગ્રાફી એન્ડ ડેવલપમેન્ટ” છે. આઈબીએસએ રાષ્ટ્રોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની આ પહેલી બેઠક હતી જે ત્રણ દેશો વચ્ચે વિશ્વના રાજકીય અને સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને સહકાર વધારવાની જરૂરિયાતનું પ્રતિબિંબ પાડે છે.
3. ભારત, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા ત્રણ મોટા વિકાસશીલ દેશો છે જે ત્રણ અલગ અલગ ખંડમાં આવેલા છે અને લોકશાહી તથા અનેકવાદના સમાન સિદ્ધાંતોથી જોડાયેલા છે. આ ત્રણેય દેશો સમુદ્રકાંઠો પણ ધરાવે છે.
4. આ બેઠક દરમિયાન સમુદ્ર સુરક્ષા, ત્રાસવાદ સામેની લડાઈ અને આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાખોરી તથા સાઈબર સિક્યોરિટી વિશે ચર્ચા કરવામાં આવી હતી. સહભાગીઓ એ બાબતે સહમત થયા હતા કે ત્રાસવાદ, ખાસ કરીને રાષ્ટ્રોના ટેકાથી ફેલાવાતો સરહદપારનો ત્રાસવાદ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સામે મોટું જોખમ પેદા કરે છે અને તેનો સંગઠિત પ્રયાસો દ્વારા સામનો કરવો જોઈએ. તેઓ ઈન્ટેલિજન્સ શેરિંગમાં સહકાર વધારવા, સંબંધિત રાષ્ટ્રીય એજન્સીઓ વચ્ચે શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાનપ્રદાન અને ક્ષમતા ગઠનની બાબતે પણ સહમત થયા.
5. સમુદ્રી સુરક્ષાને ભવિષ્યના સહકારના મહત્વના ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવી હતી. તે ચાંચિયાગીરી અને ડ્રગ અને માનવ તસ્કરી સામે લડવા માટેની વ્યવસ્થાને મજબૂત કરવા અને સંદેશાવ્યવહાર અને ઉર્જાની દરિયાઈ લાઈનોની સુરક્ષા અને માછીમારી સહિત દરિયાઈ સંસાધનોના ટકાઉ શોષણને સુનિશ્ચિત કરવા માટે સંમત થયા હતા. ત્રિપક્ષીય 'IBSAMAR' દરિયાઈ ક્વાયતનો આગલો રાઉન્ડ વહેલી તકે યોજાશે. ભારતે 2022માં મિલન નૌકા ક્વાયત માટે બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાને પણ આમંત્રણ આપ્યું હતું. ભારતે દરેક દેશની સંબંધિત શક્તિ અને નૌકા પ્લેટફોર્મ સહિત પ્લેટફોર્મ્સના સંયુક્ત વિકાસ માટે સંસાધનોના સંકલનના આધારે સંરક્ષણ ઉદ્યોગો વચ્ચે સહકારની દરખાસ્ત કરી હતી.

7. ત્રણેય દેશોના પ્રતિનિધિઓએ સાયબર સુરક્ષામાં વ્યવહારુ સહયોગ વધારવા માટે પણ સંમતિ દર્શાવી અને સાયબર સુરક્ષા પર નિષ્ણાતોની જૂથ બેઠક યોજવાની ભારતની ઓફર સ્વીકારી હતી. તેઓ સાયબર અને આઈસીટી મુદ્દાઓ પર યુએનમાં સંકલનને વધુ મજબૂત કરવા પણ સંમત થયા હતા.

નવી દિલ્હી

ઓગસ્ટ 25, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.